

M.Com Semester - 3 (CBCS) Examination
DEC/JAN. - 2020 [OLD COURSE]
ADVANCED CORPORATE ACCOUNTING(CORE)

Time: 1:30 Hours

Marks: 42

Instructions:

1. Figure to the right indicate marks.
2. There are five questions in the question paper.
3. Answer any three of the following questions.

પ્રશ્ન.૧ તા. 31-03-2020 નાં રોજ પૂરા થતાં વર્ષનું દિનેશ લિ. નું નફા-નુકસાન ખાતું નીચે આપેલું છે. (૧૪)
 સંચાલકીય ડિરેક્ટર્સ અને અન્ય ડિરેક્ટરને ચોખ્ખા નફાનાં અનુક્રમે 5% અને 1% કમિશન ચૂકવવાની ગણતરી કરો.

તા. 31-03-2020 નાં રોજ પૂરા થતાં વર્ષનું નફા-નુકસાન ખાતું

વિગત	રકમ રૂ.	વિગત	રકમ રૂ.
વહીવટી અને વિતરણ ખર્ચા	400000	કાચો નફો	1200000
લોનનું વ્યાજ	50000	રોકાણ વેચાણનો નફો (લાંબા ગાળાનાં રોકાણો)	15000
મેનેજીંગ ડિરેક્ટરનું મહેતાણું	15000	શેર પર ડિવિડન્ડ	9000
ઘસારો (કંપનીધારા શેડ્યુલ XIV મુજબ રૂ. 45000 છે.)	55000	ટ્રાન્સફર ફી	1000
ડિરેક્ટરોની ફી	4000		
મૂડી પરત અનામત	40000		
કરવેરાની જેગવાઈ	250000		
વિકાસ વળતર અનામત	15000		
ચોખ્ખો નફો	396000		
	1225000		1225000

પ્રશ્ન.૨ A અને B લિ. નાં તા. 31-12-2019 નાં રોજનાં પાકા સરવૈયાં નીચે મુજબ છે. (૧૪)

જવાબદારી	A લિ. રૂ.	B લિ. રૂ.	મિલકતો	A લિ. રૂ.	B લિ. રૂ.
શેરમૂડી 10 રૂ. નો તેવા રૂ. 5 ભરપાઈ નફા નુકસાન ખાતું (1-1-2019) 2019 નો નફો	2,00,000 5,000 20,000	50,000 2,000 8,000	ચંત્રો રોકાણો: B લિ. ના 9000 શેર તા.01-07-2019 નાં રોજ ચાલુ મિલકતો બાદ ચાલુ દેવા	1,25,000 70,000 30,000	47,500 - 12,500
	225000	60,000		225000	60,000

B લિ. ના ચંત્રનું A લિ. દ્વારા તા. 01-07-2019 નાં રોજ રૂ. 60,000 માં પુનઃમૂલ્યાંકન કર્યું હતું. (જેની B લિ. નાં ચોપડે અસર નોંધેલ નથી) વાર્ષિક ઘસારાનો દર 5% નો છે. તા. 31-12-2019 નાં રોજનું એકત્રિત પાકા સરવૈયું તૈયાર કરો.

જવાબદારીઓ	રકમ રૂ.	મિલકતો	રકમ રૂ.
૧૨% પ્રેફરન્સ શેરમૂડી	૧૨,૦૦,૦૦૦	કાયમી મિલકતો	૪૫,૦૦,૦૦૦
ઈક્વિટી શેરમૂડી	૫૧,૦૦,૦૦૦	બેંક સિલક	૬,૦૦,૦૦૦
લેણદારો	૧૮,૦૦,૦૦૦	અન્ય ચાલુ મિલકતો	૨૨,૫૦,૦૦૦
		બાંચધરી કમિશન	૭૫૦૦૦૦
	૮૧,૦૦,૦૦૦		૮૧,૦૦,૦૦૦

અન્ય માહિતિ:

૧. અપેક્ષિત વળતર દર ૧૫% છે.
૨. કાયમી મિલકતોની બજાર કિંમત ૧૦% ઓછી છે, જ્યારે અન્ય ચાલુ મિલકતોની બજાર કિંમત ૧૨% વધારે છે.
૩. ડિવિડન્ડ વહેંચાયેલા પહેલાનો સરેરાશ વાર્ષિક નફો રૂ. ૮૨૩૫૦૦ છે.
ઉપરની વિગતો પરથી મૂડીકૃત અધિક નફાની રીતે પાઘડી શોધો.

પ્રશ્ન.૪ નીચેનાં ઉપર ટૂંકનોંધ લખો.

(૧૪)

૧. માનવ સંપત્તિની પડતર અને ખર્ચાઓ
૨. ભારતમાંના પર્યાવરણલક્ષી કાયદાઓ

પ્રશ્ન.૫ નીચેના ઉપર નોંધ લખો. (કોઇપણ બે)

(૧૪)

૧. ડિરેક્ટરોનું મહેતાણું
૨. શાસક કંપનીનાં ફાયદાઓ
૩. બ્રાન્ડ અને અદ્દશ્ય મિલકતોનું મૂલ્યાંકન (AS-26 નાં સંદર્ભમાં)
૪. XBRL અહેવાલ પ્રેષણ (e-xensible Business Reporting Language)

ENGLISH VERSION

Q.1 The profit and Loss account of Dinesh Ltd. For the year ended as on dated 31-03-2020 is given below. Calculate commission payable to the managing directors and other directors @ 5% and 1% of net profits respectively.

(14)

Profit and Loss Account for the year ended Dt-31-03-2020

Particular	Rs.	Particular	Rs.
To Administrative and Distribution expenses	400000	By Gross Profit	1200000
To Interest on loan	50000	By profit on sale of Investment (Long Term Investments)	15000
To Managing Directors Remuneration	15000	By Dividend of Share	9000
To Depreciation (Which Is Rs. 45000 as schedule XIV of companies Act)	55000	By Transfer fee	1000
To Director's fee	4000		
To Capital Redemption Reserve	40000		
To Provision for Taxation	250000		
To development rebate Reserve	15000		
To Net Profit	396000		
	1225000		1225000

Q.2 The following are the Balance sheets of A and B Ltd. As on 31-12-2019. (14)

Liabilities	A Ltd Rs.	B Ltd Rs.	Assets	A Ltd Rs.	B Ltd Rs.
Share capital of Rs. 10 and Rs. 5 Paid	2,00,000	50,000	Machinery	1,25,000	47,500
Profit & Loss A/c (01-01-2019)	5,000	2,000	Investments (9000 shares In B Ltd. On 01-07-2019)	70,000	-
Profit on 2019	20,000	8,000	Current assets less current Liabilities	30,000	12,500
	225000	60,000		225000	60,000

Machinery of B Ltd. Was Revalued on 01-07-2019 by A Ltd. At Rs, 60,000 (But on which adjustment was effected Is the books of B Ltd.) depreciation Is charged @ 5% P.A Rate

Prepare the consolidated Balance sheet as on 31-12-2019.

Q.3 The Balance sheet of Bharat Ltd. As on 31-03-2020 Is as Under. (14)

Liabilities	Rs.	Assets	Rs.
12% Pref. Share Capital	12,00,000	Fixed assets	45,00,000
Equity Share Capital	51,00,000	Bank Balance	6,00,000
Creditors	18,00,000	Other current assets	22,50,000
		Under writing commission	750000
	81,00,000		81,00,000

Other Information:

- Expected Rate of Return Is 15%
- The Market Price of fixed assets Is 10% Less, while the market price of other current assets Is 12% high.
- Average annual profit before distribution of dividend Is Rs. 8,23,500.
Find out goodwill by capitalization of super profit method.

Q.4 Write short notes on the following. (14)

- Cost & Expenses of Human Resources.
- Environmental Acts In India.

Q.5 Write notes on the followings. (any two) (14)

- Remuneration of Directors.
- Advantages of Holding Company
- Brands and Intangible Assets's valuations. (With Reference to As 26)
- XBRL Reporting (e-xensible Business Reporting Language)
